

CIN: L27320GJ2016PLC094314

Ph.: +91 288 2730088 / 2730099

Fax.: + 91 288 2730786 E-mail : info@poojametal.com Website : www.poojametal.com

Plot No.1, G.I.D.C. Industrial Area, Phase II, Dared, Jamnagar - 361 004 (Gujarat) INDIA

Date: August 19, 2021

To, **BSE Limited**PhirozeJeejeebhoy Towers,

Dalal Street,

Mumbai - 400001.

Respected Sir/Ma'am

Sub- Newspaper Advertisement of 5th Annual General Meeting of the Members of Poojawestern Metaliks Limited.

Ref: Poojawestern Metaliks Ltd(Scrip Code:540727)

With reference to caption subject, we would like to inform you that the Notice of 05th Annual General Meeting (AGM) was published on Thursday August 19, 2021 in "Financial Express" in English Newspaper and in "Financial Express" Gujarati Language.

Further, Pursuant to Regulation 30 of SEBI (Listing Obligation and Disclosure requirement) Regulations, 2015 and Schedule III, Kindly note that the Company has completed the process of issuing notice of AGM to the members along with Annual Report For the Financial year 2020-21 and instruction for e-voting & attaining AGM through VC/OAVM on 18th August 2021.

Please find enclosed herewith the copy of Newspaper advertisement of the Annual General Meeting and instruction for e-voting VC/OAVM.

Please take the same on your record.

For, Poojawestern Metaliks Limited

ZIWI I V. I SC

Anil Devram Panchmatiya Whole Time Director

DIN: 02080763

Encl:a/a

12 FINANCIAL EXPRESS




MEGHMANI ORGANICS LIMITED

(Formerly known as Meghmani Organochem Limited) Registered Office: "Meghmani House" Behind Safal Profitaire, Corporate Road, Prahladnagar, Ahmedabad- 380 015.

E-mail: helpdesk@meghmani.com, Website: www.meghmani.com CIN No.: U24299GJ2019PLC110321

Q1 FY22 YoY (Rs. In Lakhs)





Statement of Unaudited Standalone Financial Results for the Quarter ended June 30, 2021

(Rs. In Lakhs, except stated otherwise)

Sr. No	Particulars	Quarter ended 30/06/2021	Quarter ended 30/06/2020	Year ended 31/03/2021	
		Unaudited	Unaudited	Audited	
1	Revenue from Operations	49,567.39	29,425.84	1,62,344.28	
2	Net Profit / (Loss) for the period before tax (before Exceptional and/or Extraordinary items #)	9,096.45	3,824.07	24,283.03	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	9,096.45	3,824.07	24,933.03	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	6,813.26	2,848.34	18,501.43	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6,818.35	2,793.05	18,521.78	
6	Equity Share Capital	2,543.14	2,543.14	2,543.14	
7	Reserves (excluding Revaluation Reserve)			1,14,183.17	
8	Earnings Per Share of Rs.1/- each (for continuing and discontinued operations.				
	Basic (in rupees)	2.68	1.12	7.28	
	Diluted (in rupees)	2.68	1.12	7.28	

Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and loss in accordance with Ind-AS Rules.

- The above financial results, have been reviewed by the Audit Committee and the Board of Directors at its meeting. held on 10th August, 2021.
- Financial Results are available on the website of Stock Exchanges (i.e. www.nseindia.com and www.bseindia.com) and on the Company's website www.meghmani.com.
- 3. The above results are in compliant with Indian Accounting Standards (Ind AS) notified by the Ministry of Corporate
- This advertisement is not a statutory advertisement as prescribed under SEBI (LODR) Regulations, 2015.

For and on behalf of Board of Directors Meghmani Organics Limited (Formerly known as Meghmani Organochem Limited) Ashish Soparkar Managing Director (DIN 00027480)

Date: 18.08.2021

Place: Ahmedabad

MEGHMANI FINECHEM LIMITED

Registered Office: CH/1 and CH/2,GIDC Industrial Estate, Dahej, Tal. Vagra, Dist. Bharuch - 392130.

E-mail: info@meghmanifinechem.com, Website: www.meghmanifinechem.com

CIN No.: U24100GJ2007PLC051717

Q1 FY22 : YoY 290.34

111 %

REVENUE





(Rs. In Crore)

Statement of Unaudited Standalone Financial Results for the Quarter ended June 30, 2021

(Rs. In Lakhs, except stated otherwise)

Sr. No	Particulars	Quarter ended June 30, 2021	Quarter ended June 30, 2020	Year ended March 31,2021
		Unaudited	Unaudited	Audited
1	Revenue from Operations	29,034.54	13,759.48	82,860.03
2	Net Profit / (Loss) for the period before tax (before Exceptional and/or Extraordinary items)	5,898.32 2,750.43		16,085.76
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)		5,898.32	2,750.43	16,085.76
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3,695.63 1,786.99		10,083.90
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,691.24	1,780.23	10,066.33
6	Equity Share Capital	4,155.27	4,155.27	4,155.27
7	Reserves (excluding Revaluation Reserve)	1000000	32.	43,166.13
8	Earnings Per Share of Rs.1/- each (for continuing and discontinued operations.			
	Basic (in Rupees)	8.89	4.34	24.27
	Diluted (in Rupees)	8.89	3.08	17.26

- 1. The above financial results, have been reviewed by the Audit Committee and Board of Directors at its meeting held on 10" August, 2021.
- Financial Results are available on the website of Stock Exchanges (i.e. www.nseindia.com and www.bseindia.com) and on the Company's website www.meghmanifinechem.com.
- 3. The above results are in compliant with Indian Accounting Standards (Ind AS) notified by the Ministry of Corporate
- This advertisement is not a statutory advertisement as prescribed under SEBI (LODR) regulations, 2015.

For and on behalf of Board of Directors MEGHMANI FINECHEM LIMITED Maulik Patel (DIN 02006947)

Date: 18.08.2021 Place: Ahmedabad **Chairman and Managing Director**

RELIGARE HOUSING DEVELOPMENT FINANCE CORPORATION LTD.

Regd. Office : P-14 45/90, P-Block, First Floor, Connaught Place, New Delhi -110001. Central Office: 1st Floor, Prius Global Tower, A-3, 4, 5, Sector- 125, Noida-201301

RELIGARE HOME

POSSESSION NOTICE [(Appendix IV) Rule 8(1)]

Whereas the undersigned being the Authorized officer of Religare Housing Development Finance Corporation Limited (RHDFCL), a Housing Finance Company registered with National Housing Bank (fully owned by Reserve Bank of India) under the provision of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 OF 2002) (hereinafter referred to as "RHDFCL") and in exercise of the powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued a Demand Notice to the following ("The Borrower") and (The Co-Borrower) to repay the amount mentioned in the notice along with interest and the other charges thereon within 60 days from the date of receipt of the said notice. "The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned

13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on the as per mentioned date. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the Property and any dealings with the property will be subject to the charge of "RHDFCL" for the amounts and interest thereon mentioned against account herein below.

has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, If the borrower clears the dues of the "RHDFCL" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or

	Name and address of the	Date and Amount of			
S. No		the Demand Notice	Schedule of Property		
1.	Mr. Bharatbhai B Sarvaiya And Vilasben Bharatbhai Saravaiya Both R/o: 77 Laxmipark Socity Ramapir Mandir Ni Bajuma Laskalagam Surat City Varachha Road Surat Gujarat-395006, Also: 431 Top Floor Laxmipark Society Nr Ramdevpir Temple Laskana Surat Gujarat-395006 and Manish Sukhabhai Kavad R/o: 410, Park Society Laskana, Surat Gujarat-395008	Demand Notice Date: 28-04-2021 Rs.7,75,876.6/- (Rs. Seven Lac Seventy Five Thousand Eight Hundred Seventy Six & Six Paisa Only)	All Pieces And Parcel of Property Bearing Flat No.203, on the Second Floor Adnieasuring 350 Sq. Feet i.e. 32.52 Sq. Mts., Built Up Area & 583.33 Sq. Feet i.e. 54.19 Sq. Mts. Super Built Up Area, Along With Undivided in the Land of 'Siddhivinayak Residency of Nilam Nagar Tenement', Situated at Revenue Survey No.26, Block No.82 Admeaujring 1-56-82 Sq.mts. Palki Plot No.15 to 19 Admeasuring 410.15 Sq.Mts of Moje Village Sayan, Taluka Olpas, District Surat Gujarat-394130 Date of Possession: 17.08.2021		
2.	Mr. Chirag Chandrakant Patel And Sudhaben C Patel Both R/o: 202 Shree Residency Main Road Siyabaug Nr Mithiba Hall Vadodara Gujarat 390001, Also At: C-	Demand Notice Date: 28-04-2021 Rs.13,31,049.16/-	All That Piece And Parcel of Property of Bearing Non- agricultural Plot of Land in Mauje Babajipura Vibhag B, Tikka No.15/5, C.S. No.9 Admeasuring 111-20-53 Sq. Mtrs., Known As "Shree Residency" Paikki Second Floor, Flat No.202		

Thirty One

Thousand Forty

Khanderao Market, Rajmahal Road, Nine & Sixteen No.36, East: By Open Road, West: By Flat No. 201. Vadodara, Gujarat-390001 Paisa Only) Date of Possession: 14.08.2021 Date: 19-08-2021

Authorised Officer

District & Sub-District Vadodara District Vadodara Gujarat

390001, and Bounded As: North: By C.S. No.37, South: By C.S.

M/s Religare Housing Development Finance Corporation Ltd.

(Rs. Thirteen Lac | Construction Admeasuring 53.43 Sq. Fts., at Registration

POOJAWESTERN METALIKS LIMITED Corporate Identity Number (CIN): L27320GJ2016PLC094314

Place: Surat/Vadodara

206-Vadodara, Baroda-390001, Also At:

Shree Parsottam Ambala, Plot No 74,

Regd Office: Plot No.1, Phase II,GIDC, Dared, Jamnagar, Gujarat - 361004, India Tel No: 288-2730088, Website:www.poojametal.com,Email-poojametals@gmail.com NOTICE OF THE 05" ANNUAL GENERAL MEETING OF

THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that in view of the continuing Covid-19 pandemic and in accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020and Circularno, 02/2021 dated January 13, 2021 in relation to "Clarification on holding of annual general meeting (AGM) throughvideo conferencing (VC) or other audio visual means (OAVM)" (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physica presence of Members at a common venue, the Fifth(5th) Annual General Meeting (AGM) of the Members of PoojawesternMetaliks Limitedwill be held on Tuesday, September 14, 2021 at 12:00P.M. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 5th AGM.

In accordance with the General Circular No. 20/2020 dated May 5, 2020 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13,2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12,2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/ P/2021/11 dated January 15, 2021 issued by the Securities ExchangeBoard of India (SEBI)the Notice of AGM along with Annual Report 2020-21have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories Member may note that Notice and Annual Report 2020-21have been uploaded on the website of the Company at www.poojametal.com,website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL)i.e www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 5thAGM and Annual Report 2020-21 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to poojametals@gmail.com In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID +
- CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to poojametals@gmail.com.
- Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.infor obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be. Post successful registration of the e-mail address, the shareholder would get soft

copies of notice of 5thAGM and Annual Report 2020-21and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 5thAGM. In case of any queries, shareholder may write to the Company at poojametals@gmail.com. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Wednesday, September 08, 2021 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Saturday, September 11, 2021 and will end on 5:00 P.M. on Monday, September 13, 2021. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 5th AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 5thAGM may also attend the 5thAGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the 5thAnnual General Meeting. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Wednesday, September 08, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or poojametals@gmail.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Mr. Tejus Pithadiya, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to poojametals@gmail.com or may call on +91-0288-2730088for any further

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Annual General Meeting are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Pooja Western Metaliks Limited **Sunil Panchmatiya**

Place: Jamnagar **Date:** August 18, 2021 Chairman & Managing Diector DIN: 02080742





Ahmedabad

financialexp.epapr.in

સોના– ચાંદીના વાયદાના ભાવોમાં નરમાઇ : કોટન, સીપીઓમાં ઘટાડો : કપાસ, ૨બ૨, મેન્થા તેલમાં સુધારાનો સંચાર

કોમોડિટી બ્યુરો મુંબઇ, તા. ૧૮

સુચકાંક મેટલડેક્સના ઓગસ્ટ સન્નની

મૂવમેન્ટ રહી હતી. વાયદાઓમાં સોનું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.૯૦ ઉપરમાં રૂ.૪૭,૪૩૭ અને હતો. નીચામાં રૂ.૪૭,૧૪૨ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૯૩ ૧૭,*૬૬*૧

અને બિનલોહ ધાતુઓના સપ્ટેમ્બર વાયદો ૧ કિલોદીઠ ટ્રેડથઈ રહ્યો હતો.

ઘટી રૂ.૪૭,૧૮૭ના ભાવે ટ્રેડ રૂ.૩,૧૮૪.૭૮ કરોડના વેપાર બોલાઈ રહ્યો હતો. થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ- થયા હતા. એલ્યમિનિયમ દેશના અત્રણી કોમોડિટી ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૮ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ ૨,૦૭૫ એક્સચેન્જ ગ્રામદીઠ રૂ.૩૨ ઘટી રૂ.૦.૮૫ ઘટી રૂ.૨૦૬.૬૦ રૂ.૨૬૧.૧૯કરોડનાં કામકાજ રૂ.૯૨૭.૨૦ અને કોટન સેગમેન્ટમાં ક્રૂડ તેલના સત્રનાં અંતે સોનાના વિવિધ કરોડનાં ૧,૩૮૮ લોટ્સના એમસીએક્સ પર વિવિધ રૂ.૩૭,૯૩૮ અને ગોલ્ડ-પેટલ અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ થયા હતા. કપાસ એપ્રિલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ વાયદાઓમાં કોમોડિટી વાયદા, ઓપ્શન્સ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧.૩૦ઘટી રૂ.૨૪૭ના ભાવે વાયદો ૨૦ કિલોદીઠ સત્રની રૂ.૫૦ ઘટી રૂ.૨*૬*,૫૭૦ સોદાઓમાં અને ઈન્ડેક્સ ક્યુચર્સમાં રૂ.૧૨ઘટી રૂ.૪,૬૭૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે શરૂઆતમાં રૂ.૧,૪૯૦ના બોલાઈ રહ્યો હતો. બુધવારે પ્રથમ સત્ર સુધીમાં ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ભાવે ખૂલી, દિવસ દરમિયાન કામકાજની દૃષ્ટિએ કીમતી અને નેચરલ ગેસના એલ્યુમિનિયમમાં ૧૨,૭૦૦ લોટ્સ અને મેટલડેક્સ ૧,૧૩,૨૭૬ સોદાઓમાં કુલ સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫.૨૫ ઘટી રૂ.૭૦૪.૪૫ ઉપરમાં રૂ.૧૪૯૦ અને ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં કરોડનું રૂ.૪૭,૩૨૪ના ભાવે ખૂલી, અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ નીચામાં રૂ.૧૪૭૯.૫૦ સુધી વાયદાઓમાં ૧૧,૪૭૪ સોદાઓમાં રૂ.૧,۶૪૦.૯૦ ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ટર્નઓવર નોંધાયું હતું. કીમતી રૂ.૯૨ ઘટી રૂ.૪૭,૧૧૪ના રૂ.૧૯.૪ ઘટીરૂ.૧,૪૪૧.૬૦ જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૧૨ સોદાઓમાં રૂ.૧,૭૮૧.૯૩ કરોડનાં ૫,૭૪,૪૫,૦૦૦ ૧૭,૧૮૨.૫૦૦ ટન, નિકલ ઓગસ્ટ વાયદો ૧૪,૨૪૨ના ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ વધી રૂ.૧,૪૮૮ બોલાઈ રહ્યો કરોડનાં ૩,૭*૬૬*.૪૪૮ કિલો એમએમબીટીયૂનો ધંધો થયો વાયદામાં ૩,૦૨૫.૫૦૦ ટન, સ્તરે ખૂલી,ઊપરમાં ૧૪,૨૫૫

વાયદામાં ૨૬૦ પોઈન્ટની રૂ.૬૩,૪૭૫ દિવસ દરમિયાન ૩૫,૧૩૧ સોદાઓમાં કુલ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧,૦૨૭.૯૫ કરોડનાં સોદાઓમાં રૂ.૧.૦૪ કરોડનાં ૨,૩૯,૯૨,૫૦૦ ઉપરમાં રૂ.૪૩,૫૫૦ અને રૂ.૨,૩૪૮.૭૭ કરોડનો ધંધો રૂ.૧૮,૩૯૦ અને નીચામાં ૧.૪૧.૭૧૦ ટનના વેપાર થયા ૧૪૦ ટન અને કોટનના એમએમબીટીયૂ તેમ જ હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ કીમતી ધાતુઓમાં સોના- નીચામાં રૂ.૪૩,૧૦૦ સુધી થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.૧૮,૦૬૫ સુધી જઈ, પ્રથમ હતા. બિનલોહ ધાતુઓમાં વાયદાઓમાં ૪૫૩ સોદાઓમાં કપાસમાં ૨૦૪ ટન, કોટનમાં વાયદો ૧૫,૬૫૬ના સ્તરે ચાંદીમાં ૪૫,૦૮૦ સોદાઓમાં જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૮૧ વાયદો સત્રની શરૂઆતમાં સત્ર સુધીમાં રૂ.૨૩૧ વધી એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.૩૪.૬૯ કરોડનાં ૧૩૦૦૦ ૮૫૦૭૫ ગાંસડી, મેન્થા તેલમાં ખૂલી, ૨૬૦ પોઈન્ટની મૂવમેન્ટ કુલ રૂ.૨,૮૦૯.૮૮ કરોડનાં ઘટી રૂ.૪૩,૧૪૫ બોલાઈ રહ્યો રૂ.૪,૯૫૫ના ભાવે ખૂલી, રૂ.૧૮,૩૪૩ના ભાવે ટ્રેડ થઈ રૂ.૨૧૦.૨*૬* ા કામકાજ થયાં હતાં. સોનાના હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ દિવસ દરમિયાન ઉપરમાં રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ ૧૦,૧*૬*૫ ટન, જસતના વાયદાઓમાં ૨૧૦ સોદાઓમાં ટન, સીપીઓમાં ૮*૬*,૪૮૦ ૧૫,૪*૬*૪ના સ્તરે પહોંચ્યો ઘટી રૂ.૫,૦૧૩ અને નીચામાં કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ વાયદાઓમાં રૂ.૩૨*૬*.૩૦ રૂ.૮.૪૩ કરોડનાં ૯૦.૭૨ ટનનાસ્તરેરહ્યો હતો.ઈન્ડેક્સ હતો. વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની રૂ.ક૩,૪૦૫ અને ચાંદી-મિની રૂ.૪,૯૫૧ સુધી જઈ, પ્રથમ રૂ.૧,૧*૬૬.૬*૦ના ભાવે કરોડનાં ૧૩,૧૭૫ ટન, તાંબુ ટન, રબરના વાયદાઓમાં ૫૧ ફ્યુચર્સની વાત કરીએ તો, શરૂઆતમાં રૂ.૪૭,૩૭૪ના ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.૧૦૪ ઘટી સત્ર સુધીમાં ૧ બેરલદીઠ રૂ.૪૬ ખૂલી,દિવસદરમિયાન ઉપરમાં કોન્ટ્રેક્ટ્સમાં રૂ.૧,૬૧૬.૬૦ સોદાઓમાં રૂ.૧.૧૯ કરોડનાં પ્રથમ સત્ર સુધીમાં ૧,૬૯૩ તો, કોમોડિટી વાયદા પરના ભાવે ખૂલી, દિવસ દરમિયાન રૂ.કુ૩,૪૦૦ બોલાઈ રહ્યો વધીરૂ.૫,૦૦૨ બોલાયો હતો, રૂ.૧૧૭૪ અને નીચામાં કરોડનાં ૨૨,૭૬૦૦ ટન, કપ ટનના વેપાર થયા હતા. સોદાઓમાં રૂ.૧૪૩.૫૩ ઓપ્શન્સમાં ધાતુઓમાં વાયદો ૧ એમએમબીટીયુદીઠ સુધીમાં રૂ.૧૨.૪૦ ઘટી રૂ.૯૨૨.૮૫

કૃષિ ઓગસ્ટ વાયદામાં ૯૨ પોઈન્ટ ચાંદીના વાયદાઓમાં ચાંદી રૂ.૦.૩૦ઘટીરૂ.૧૭૯નાભાવે હતો. આ સામે રબર ઓગસ્ટ અને ચાદીના વિવિધ હતો. વાયદો ૧૦૦ કિલોદીઠ વાયદાઓમાં સેગમેન્ટમાં રૂ.૧૮,૦૯૪ના ભાવે ખુલી, સોદાઓમાં જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.૧૧૫૯સુધીજઈ,પ્રથમસત્ર નિકલના

મેન્થા હતો. કોમોડિટીઝમાં વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કરોડનાં ક,૨૦૦ ટનનાં હતાં. સોદાઓમાં ૧ કિલોદીઠ રૂ.૪.૬૦ વધી કામકાજ થયાં હતાં. એનર્જી

33,505 વાયદાઓમાં સીપીઓના કરોડનાં ૧.૩૩*૬* સોદાઓમાં રૂ.૧.૪૦ વધી રૂ.૨૮૪.૮૦ રૂ.૧૧૪૭.૪૦ બોલાઈ રહ્યો ૪,૩૭૨૦ ટન અને સીસું રૂ.૨૧૫.૮૪

કરોડનાં ૧૪,૨૨,૧૦૦ બેરલ વાયદાઓમાં ક્૯૯.૩૭૮ ટન, બુલડેક્સ વાયદામાં ૨,૨૮૩

કૃષિ કુલ કપાસના વાયદાઓમાં ૨૫ બેરલ અને નેચરલ ગેસમાં મૂવમેન્ટ સાથે ૩૫ પોઈન્ટ ઘટી કરોડનાં ગાંસડી, મેન્થા તેલના ૪૪૫.૬૮ટન,૨બ૨માં૧૫૯ સાથે ૧૩૪ પોઈન્ટ ઘટી

તેલના કોન્ટ્રેક્ટ્સમાં રૂ.૧૧૦.૭૭ ૧૮,૭૫૦ટનનાં કામકાજથયાં કરોડનાં ૫૦૦ લોટ્સ અને

૮,૭૪૩ વાયદાઓમાં ૧*૬*,૨૧*૬*.૫૮૩ વેપાર થયા હતા. ઓપન રૂ.૭૦૭.૮૭ કિલો અને ચાંદીના વિવિધ ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૬,૩૮૮ ટન, જસત વાયદામાં ૯,૦૨૫ વાયદામાં ૧,૦૬૨ લોટ્સના સીસું કોન્ટ્રેક્ટ્સમાં ૫,૮૮૦ અને નીચામાં ૧૪,૧૬૩ના કોમોડિટીઝમાં ટન, ક્રૂડ તેલમાં ૫,૨*૬,૬*૦૦ સ્તરને સ્પર્શી, ૯૨ પોઈન્ટની

વાયદાઓમાં કરોડનાં કામકાજ થયાં હતાં, સોદાઓમાં સોદાઓમાં જેમાં બુલડેક્સ વાયદામાં ૪૭૮ કરોડનું નોશનલ ટર્નઓવર કરોડનાં સોદાઓમાં

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સોદાઓમાં રૂ.૧૦૭.૯૯

રૂ.૩૫.૫૪ નોંધાયું હતું.

રેલીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાચનાન્સ કોર્પોરેશન લીમીટેડ. રજીસ્ટર્ડ ઓફીસ : પી-૧૪, ૪૫/૯૦, પી-બ્લોક, પહેલો માળ, કોર્નટ પેલેસ, નવી દિલ્હી-૧૧૦૦૦૧.

RELIGARE HOME

કબજા નોટીસ (પરિશિષ્ટ ૪) નિચમ ૮ (૧)

આથી અહીં નીચે સહી કરનાર **રેલીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ (આરએચડીએફસીએલ) હાઉસિંગ ફાયનાન્સ કંપની કે જે નેશનલ હાઉસિંગ બેન્ક (સંપુર્ણપણે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હસ્તક)** માં નોંધાચેલી છે તેના અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓક કાયનાન્સિયલએસેટસઅનેએનકોર્સમેન્ટ ઓક સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (૨૦૦૨ ની ૫૪)(અહીં પછી તેને "**આરએચડીએકસીએલ"** તરીકે સંબોદ્ધેલ છે) ની જોગવાઇઓ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ના રૂલ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ **("દેવાદાર")** અને **("સહ–દેવાદાર")** નોટીસમાં જેણાવેલ સ્કમનો વ્યાજ અને અન્ય દરો સાથે ઉપરોક્ત નોટીસ મળ્યાની તારીખથી દૃ૦ દિવસની અંદર પરત ચૂકવણી કરવા માટે માંગણા નોટીસ જારી કરી હતી. દેવાદાર આ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર અને જાહેર જનતાને આથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે નીચે દર્શાવેલ

મિલકતોનો સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રુલ્સ ૨૦૦૨ના રૂલ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને

જ્યાવેલ તારીખે કબજો લઇ લીધો છે. . માંથી ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો '**આરએચડીએક્સીએલ''**ની અહીં નીચે એકાઉન્ટ સામે જણાવેલ રકમો અને તેના પરના વ્યાજના ચાર્જને આધિન રહેશે.

કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે, જો દેવાદાર વેચાણ અથવા તબદીલીની નિયત તારીખ પહેલા કોદપણ સમયે તમામ લાગ કોસ્ટ, ચાર્જ અને ખર્ચા સહીત **"આરએચડીએક્સીએલ"** ના બાકી લેણાંની પતાવટ કરે છે. તો **"આરએચડીએક્સીએલ"** દારા સિક્ચોર્ડ એસેટનું વેચાણ કે તબદીલી કરવામાં આવશે નહી અને સિક્ચોર્ડ એસેટની તબદીલી અને વેચાણ માટે **''આરએચડીએફસીએલ''** દ્વારા કોઇ અન્ય પગલા લેવામાં આવશે નહી.

માંગણા નોટીસની

તારીખ અને રકમ

તારીખ:

9505.80.29

પંચોત્તેર હજાર

છ પૈસા પુરા)

9505.80.55

		_		
۹.	શ્રી ભરતભાઇ બી. સરવૈયા અને વિલાસબેન			
	ભરતભાઇ સરવૈયા તમામનું સરનામું : ૭૭	l		
	લક્ષ્મીપાર્ક સોસાચટી રામપીર મંદિરની બાજુમાં	l		
	લસ્કાણા ગામ સુરત સિટી વરાછા રોડ સુરત,	;		
	ગુજરાત-૩૯૫૦૦૬, અહીં પણ : ૪૩૧ ઉપરનો	ľ		
	માળ લક્ષ્મીપાર્ક સોસાચટી રામદેવપીર મંદિર			
	પાસે લસ્કાણા સુરત ગુજરાત-૩૯૫૦૦૬ અને	l		
	મનીષા સુખાભાઈ કાવડે સરનામું : ૪૧૦, પાર્ક			
	સોસાયટી લસ્કાણા, સુરત, ગુજરાત-૩૯૫૦૦૮	l		
٤.	શ્રી ચિરાગ ચંદ્રકાંત પટેલ અને સુધાબેન સી.			
	પટેલ તમામનું સરનામું : ૨૦૨ શ્રી રેસિડેન્સી	l		
	મેઇન રોડ સીચાબાગ મીઠીબા હોલ પાસે,	l		
	વડોદરા, ગુજરાત-૩૯૦૦૦૧, અહીં પણ : સી-	l		
	૨૦૬–વડોદરા, બરોડા–૩૯૦૦૦૧, અહીં પણ : શ્રી	ľ		
	પરસોત્તમ અંબાલા, પ્લોટ નં. ૭૪, ખાંડેરાવ			
	માર્કેટ, રાજમહલ રોડ, વડોદરા, ગુજરાત–			
		ľ		
	360004			

મુંબઇ-૪૦૦ ૦૫૭. ફોન – ૧૮૦૦૧૨૩૪૪૨૭

તારીખ : ૧૯.૦૮.૨૦૨૧

સ્થળઃ સુરત

દેવાદાર/જામીનદાર/ગીરવેદારના

નામ અને સરનામાં

13,3**1,**086.98/– એક્ત્રીસ હજાર તારીખ : ૧૯.૦૮.૨૦૨૧ સ્થળ : સુરત / વડોદર

માંગણાં નોટીસની ફ્લેટ નં. ૨૦૩, બીજો માળ, ક્ષેત્રફળ ૩૫૦ ચો.ફટ એટલે કે ૩૨.૫૨ ચો.ફટ બિલ્ટ અપ એરિયા, અને ૫૮૩.૩૩ ચો.ક્રુટ એટલે કે ૫૪.૧૯ ચો.મી., સુપ૨ બિલ્ટ અપ એરિયા, તેમજ સિદ્ધિવિનાયક રેસીડેન્સી, નિલમ નગર ટેનામેન્ટ. રેવન્ચ સર્વે નં. રદ. બ્લોક નં. ૮૨. ક્ષેત્રકળ ૧.૫દ.૮૨. ચો.મી. રૂપિયા સાત લાખ પૈકી પ્લોટ નં. ૧૫ થી ૧૯, ક્ષેત્રફળ ૪૧૦.૧૫ ચો.મી., મોજે ગામ સચાણ, તાલુકો– ઓલપાસ, જિલો–સુરત, ગુજરાત–૩૯૪૧૩૦ની મિલકતના આઠસો છૌતેર અને | તમામ ભાગ અને હિસ્સા. કબજાની તારીખ: ૧૭.૦૮.૨૦૨૧ માંગણાં નોટીસની

મિલકતની વિગત

મોજેબાબજીપુરાવિભાગબી,ટિક્કાનં.૧૫/૫,સીટીસર્વેનં.૯, ક્ષેત્રફળ ચો.મી., શ્રી રેસીડેન્સી તરીકે જા ણીતી, પૈકી બીજો માળ, ફ્લેટ નં. ૨૦૨, બાંધકામ ક્ષેત્રફળ ૫૩.૪૩ ચો.ક્રુટ, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ વડોદરા, જિલો વડોદરા, ગુજરાત, ૩૯૦૦૦૧ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા: ઉત્તર: સીટી સર્વે નં. ૩૭, દક્ષિણ: સીટી સર્વે નં. ૩૬, રોડ. પશ્ચિમ: ક્લેટ નં. **૨**૦૧.

સોળ પૈસા પુરા) કળજાની તારીખ: ૧૪.૦૮.૨૦૨૧

અદ્યિકૃત અદ્યિકારી મેસર્સ રેલીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ

સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાચનાન્સ કોર્પોરેશન લીમીટેડ

ઓફીસ નં. ૧, ગ્રાઉન્ડ ફ્લો૨, પુષ્પક સીએચએસ, ગોમતાંક હોલ સામે, માલવીચા રોડ, વિલે પાર્લે (ઇસ્ટ),

svatantra

પરિશિષ્ટ ૪ (જુઓ નિચમ ૮(૧))

કબજા નોટીસ

આથી સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ કાયબાન્સ કોર્પોરેશન લીમીટેડ (એસએમએચએફસી) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયાબાન્સિયલ એસેટ્સ અને એન ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટીઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનેફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ સાથે વેંચાતી કલમ ૧૩ હેઠળ મળેતી સત્તાનો ઉપયોગ કરીને નીચે જ્યાવેલ તારીખે માંગણા નોટીસ જારી કરી કોષ્ટકમાં જણાવેલ દેવાદારોને નોટીસમાં જણાવેલ રકમ તેના પરના વ્યાજ અને ખર્ચ સહીતજણાવેલ નોટીસ

મળ્યાની તારીખથી /નોટીસી તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/જામીનદાર/ગીરોદાર અને જાહેર જનતાને આથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે જ્યાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જ્ણાવેલ મિલકતનો કબજો લઇ લીધો છે.

ખાસ કરીને દેવાદાર/જામીનદાર/ગીરોદાર અને જાહેર જનતાને આથી સાવધ કરવામાં આવે છે કે મિલકત સાથે કોઇ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથેનો કોઇપણ વ્યવહાર સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ (એસએમએચએફસી) ની નીચે જણાવેલ રકમ અને પુરેપુરી ચુકવણી સુધી તેના પરનું ચડત વ્યાજઅને ખર્ચને આદ્યિન રહેશે.

ક્રમ	દેવાદાર(રો)/	માંગણા નોટીસની તારીખ	બાકી	મિલકતની
oi.	જામીનદાર(રો) નું નામ	કબજા નોટીસની તારીખ	લેણાં રકમ	વિગત
q	શ્રી ચંપાબેન નવિનભાઇ પટેલ શ્રી રિતેશ નવિનભાઇ પટેલ શ્રી નવિનભાઇ લક્ષ્મણભાઇ પટેલ	05-08-5054 43-06-5054	રૂા. ૫,૪૦,૦૪૭/– (રૂપિચા પાંચ લાખ ચાલીસ હુજાર સુડતાલીસ પુરા) રૂા. ૧,૮૯,૫૪૯/– (રૂપિચા એક લાખ નેવ્યાસી હુજાર પાંચસી ઓગણપચાસ પુરા)	ફ્લેટ નં.૫૧૬, ઉમંગ સચિન– ફેઝ–૧ ફાઇનલ પ્લોટનં.૧૦૪/૧,પ્લોક૧૪૮,૧૪૯,૧૫૦,સચિન– કાનસદ રોડ,સચિન–૩૯૪૨૩૦
	શ્રીમતી સઘદાબાનુ મોહમ્મદઇકબાલ શેખ શ્રી મોહમ્મદ ઇકબાલ ગુલામ શેખ	03-05-5059 93-06-5059	રૂા. ૨,૯૬,૦૦૪/– (રૂપિયા બે લાખ છક્યું હજાર ચાર પુરા)	કલેટ નં. ઇડબલ્યુએસ–૪/એ–૭૨૧, ઇડબલ્યુએસ–૪, સુમન સ્મૃતિ/ભેસ્તાન/એ, ઇડબલ્યુએસ ૪, ભેસ્તાન, ટાઉનપ્લાનિંગ૨૨,ફાઇનલપ્લોટનં.દૃ૧,સલિયાનગ૨, સફારી કોમ્પલેસ પાછળ, ભેસ્તાન, સુરત–૩૯૫૦૨૩
	શ્રીમતી નિધિ પંકજ અગ્રવાલ શ્રી પંકજ ગીરીરાજ અગ્રવાલ	08-04-2029 93-06-2029	રૂા. ૪,૨૨,૭૮૮/– (રૂપિચા ચાર લાખ બાવીસ હજાર સાતસો ઇઠ્ચાંસી પુરા)	ફ્લેટ નં. લિગ-૫/જે–303, લિગ- ૫/સુમન/આનંદ/રૂંધ/જે, એસએમસી– લિગ-૫ સુમન આનંદ– ટાઉન પ્લાનિંગ– 3 (રૂંધ) લિગ-૫ રૂંધ, ટાઉન પ્લાનિંગ ૩, ફાઇનલ પ્લોટ નં. દૃદ્દ, મહેશ્વરી વિદ્યાપીઠ સ્કુલ પાસે, મગદલા રોડ, રૂંધ, સુરત–૩૯૫૦૦૭
8	શ્રી રાજકુમાર લઘુરામ દુબે શ્રીમતી વંદનાબેન રાજકુમાર દુબે	03-05-5054 98-06-5054	રૂા. ૪,૪૬,૯૯૬/- (રૂપિયા ચાર લાખ છૈત્તાલીસ હજાર નવસો છક્ષું પુરા)	ફ્લેટ નં.૧૧૧,ઇ,ઉમંગ સચિન– ફેજ–૨,ફાઇનલ પ્લોટ નં. ૧૦૪/૧, બ્લોક ૧૪૮, ૧૪૯, ૧૫૦, સચિન–કાનસદ રોડ, સચિન–૩૯૫૦૦૭
ч	શ્રીમતી ગીતાબેન શાંતિભાઇ જોદ્યાણી શ્રી હિતેશકુમાર શાંતિભાઇ જોદ્યાણી શ્રી શાંતિલાલ ભવાનભાઇ જોદ્યાણી	03-05-5054 98-06-5054	રૂા. ૧,૭૧,૭૬૬/– (રૂપિયા એક લાખ ઇક્કોત્તેર હજાર સાતસો છાંસઠ પુરા)	ક્લેટ નં. લિગ/એફ/૦૧૦૨, ગણેશપુરા, લિગ/એફ, જીએચબી–ગણેશપુરા, એસએમસી ટેનામેન્ટપાસે,અમરોલી–કોસદ રોડ,ગણેશપુરા, સુરત–૩૯૪૧૦૭
	શ્રીમતી શોભાબેન સોની શ્રી સૌરભ સોની	98-04-5054 98-06-5054	રૂા. ૪,૫૫,૫૬૦/– (રૂપિચા ચાર લાખ પંચાવન હજાર પાંચસો સાંહીઠ પુરા)	ફલેટ નં. ઇડબલ્યુએસ–૧૪/એ–૫૦૫, ઇડબલ્યુએસ– ૧૪/સુમન સાથ/ઉતરણ કોસદ/એ, એસએમસી– ઇડબલ્યુએસ૧૪,સુમનસાથ–ટાઉનપ્લાનિંગ ૨૭–ઉતરણ કોસદ, ફાઇનલ પ્લોટ નં.૧૮૦, ઇડબલ્યુએસ૧૪, ઉતરણ કોસદ,ટાઉનપ્લાનિંગસ્કીમનં.૨૭, ફાઇનલપ્લોટનં.૧૮૦, અંબી વેલી મનિષા ગરનાળા, ઉતરણ, સુરત-૩૯૪૧૦૭
٥	શ્રી રાજેશ રામ લખમણ પાંડે શ્રી પસુપતિ નાથ પાંડે	03-05-2029 9८-0८-२0२9	રૂા. ૮,૪૪,૭૪૩/– (રૂપિયા આઠ લાખ ચુમ્માલીસ હજાર સાતસો	ફ્લેટ નં. ૧૩૮, રોહાઉસ–૧૩૮, આંગન રેસીડેન્સી સર્વે નં. ૨૮૨૧+૨, જી આઇડીસી– વાપી, ગામ– કોચરવા, તાલુકો–

તૈત્તાલીસ પુરા)

પારડી, જિલો– વલસાડ, ગુજરાત–૩૯૬૧૯૧

સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાચનાન્સ કોર્પોરેશન લીમીટેડ વતી

(શરિક સોદાગર) – અધિકૃત અધિકાર્ર

એઆરટી હાઉસિંગ ફાચનાન્સ (ઇન્ડિયા) લીમીટેડ ART

સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩

એઆરટી હાઉસિંગ ફાયનાન્સ (ઇન્ડિયા) લીમીટેડ, સરફૈસી એક્ટ, ૨૦૦૨ ની ક્લમ ૨(૧) (એમ) (૪) હેઠળ ફાયનાન્સિયલ ઇન્સ્ટીટયુશન, જે તેની રજસ્ટર્ડ ઓફીસ ૧૦૭, બેસ્ટ સ્કાય ટાવર, નેતાજી સુભાષપેલેસ, પ્રિતમપુરા, દિલ્હી–૧૧૦૦૩૪ ખાતે ધરાવે છે (અહી પછી સિક્ચોર્ડ લેણદાર તરીકે દર્શાવેલ છે) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ, નીચેના લોન એકાઉન્ટ નંબરમાં માંગણા નોટીસ બજવી છે જેમને એનપીએ તરીકે વર્ગીકૃત કરાયેલ છે.

ક્રમ નં.	લોન એકાઉન્ટ નંબર	દેવાદાર/ સહ-દેવાદારનું નામ	દેવાદાર/ સહ-દેવાદારનું સરનામું	સિક્યોર્ડ મિલકતનું સરનામું	માંગણા નોટીસ ૧૩(૨) ની તારીખ	એનપીએની તારીખ	બાકી સ્ક્રમ
q	LNAMD 01418- 190004898	સંતોષ શીલ અને શીલા અમિતા સંતોષ	એ-૧૦૨, સનરાઇઝ ટાવર, કસ્તુરી ગાર્ડન, અમૃતાવાણી સતસંગ રોડ, ભાયેન્દર વેસ્ટ, થાણે, મહારાષ્ટ્ર-૪૦૧૧૦ અને સરનામું છુ-૨, દા નેસ્ત અમૃતાવાણી સતસંગ રોડ, કસ્તુરી ગાર્ડન પાસે, ભાયેન્દર (વેસ્ટ), થાણે ભાયેન્દર, મહારાષ્ટ્ર-૪૦૧૧૦૧	અક્ષરધામ હાઇટ્સ, સરદાર પટેલ રિંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ, ગુજરાત–૩૮૨૪૧૮ ક્ષેત્રફળ દ્૫.૫૫ ચો.મી. ખાતેની મિલકત. ચતુઃસીમા ટાઇટલ દસ્તાવેજમાં		30.0ξ.2029	રૂા. ૨૦,૯૯,૮૫૯/– (રૂપિયા વીસ લાખ નવ્યાણું હજાર આઠસો ઓગણસાંહીઠ પુરા) ૦૧.૦૭.૨૦૨૧ મુજબ

. આથી નોટીસીઓને આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર ઉપર જ્ણાવેલ ૨૬મ ચુકવવા માટે જણાવવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં અહી જ્ણાવેલ સિક્ચોર્ડ એસેટોમાં આપેલ સિક્ચોર્ડ મિલકતો સામે સિક્ચોરીટી હિતને ટાંચમા લેવાના હકનો ઉપયોગ કરવાની ફરજ પડશે. આ નોટીસ એએચએફએલને પ્રાપ્ત અન્ય કોઇપણ ઉપાયો પ્રત્યે પુર્વગ્રહ વગરની છે.

સિક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની ૧૩ ના પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું દયાન દોરવામાં આવે છે ક્થળ : અમદાવાદ એઆરટી હાઉસિંગ ફાયનાન્સ (ઇન્ડિયા) લીમીટેડ

पंजाब नैशनल बैंक 🖳 punjab national bank

સર્કલ સસ્ત્ર ઓકિસ રાજકોટ - (૮૩૦૪૦૦), બીજો માળ, જેપી સેકાયર, રેસ કોર્સ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧

કબજા નોટીસ (અચલિત મિલકતો માટે)

આથી, નીચે સહી કરનાર પંજાબ **નેશનલ બેંક** ના અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન એક ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો એક્ટ<mark>ર્ન.</mark> ૫૪) ની ધારા ૧૩(૧૨) સાથે વંચાતા રૂલ ૩ ફેઠળ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ન અંતર્ગત નીચે દર્શાવેલ **તારીએ** કરજદારો/જામીનદારો/ગીરોકર્તાને ડિમાન્ડ નોટીસ જારી કરેલ હતી કે જેમાં નોટીસમાં જણાવેલ રકમ સદર નોટીસ પ્રાપ્ત થયાની તારીખર્થ ક૦ દિવસોમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. ક૨જદારો/જામીનદારો/ગીરોકર્તા આ ૨કમ ચૂકવવામાં અસફળ રહેલ છે, આથી ક૨જદારો/જામીનદારો/ગીરોકર્તા અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે **તારીખ ૧૩ ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ** ઉપરોક્ત નિયમોનાં અંતર્ગત નિયમ ૮ ના ધારા ૧૩(૪) ના અંતર્ગત નીચે હસ્તાક્ષર કરેલ અધિકારીએ પોતાના અધિકારથી નીચે દરાયિલ

મેલકતના માલિક અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી ચેતવણી આપવાની કે નીચે દર્શાવેલ મિલકતો અંગે કોઈ વ્યવહાર કરવો નહીં અને મિલકતો અંગેનો કોઈપણ મિલકતના માલિક અને જાદર જનતાન સામાન્ય રાત અહાયા યતપણા આપપાના ક નાય દશાબલ ાનવકતા અને કાઇ વ્યવણ હૃદના ગણ અને તેમા વ્યવહાર **પંજાબ નેશનલ બેંકની** નીચે દશવિલ બાકી રકમ અને ચડત વ્યાજ તથા ખર્ચા સાથે પૂરેપુરી રકમ ન ચૂકવાય ત્યાં સુધી બોજાને આધીન રહેશે. ગીરવે રાખેલ અસ્કયામતો આપેલા સમયમાં છોડાવવા અંગે કરજદાર/જામીનદાર/ગીરોદારનું કાયદાના સેક્શન ૧૩ ના સબ-સેકશન (૮) ની જોગવાઈ તરફ ધ્યાલ

અ. નં.	કરજદારો / જામીનદારો / ગીરોદારો નું નામ	ડીમાન્ડ નોટીસ તારીખ અને બાકી રકમ	અચલિત મિલકતોની વિગતો
1.	શ્રી જીજ્ઞેશ ગીરધરલાલ જોષી અને શ્રીમતી તૃપ્તિ જીજ્ઞેશ જોષી શાખા ઓફિસઃ વેરાવળ (e-UBI) (047520)	ડિમાન્ટ નોટીસ તારીખ: 11.05.2021 રૂા. 23,66,736.18/- and અને વ્યાજને આધીન	ઈક્વિટેબલ ગીરો મિલકત પ્લોટ નં. ૩૩ પૈકી ઉત્તરીય બાજુ જમીન ૭૯-૯૨ સ્કે. મીટર્સ, રેવેન્ચુ સર્વે નં. ૮૦/૧ અને ૮૫ વેરાવળ, વેરાવળ-પાટણ ની સીમા જોઈન્ટ મ્યુનિસિપલ, ટીપી સ્કીમ નં. ૧ માં શામેલ જૂનો પ્લોટ નં. ૯, ગીતા નગર-૧, નાલંદા સ્કૂલ પાસે, સીટી વેરાવળ, તાલુકા - વેરાવળ, જીકોઃ ગીરે-સોમનાથમાં આવેલ મિલકત જે તૃપ્તિબેન જીજ્ઞેશભાઈ જોષીની માલીકી અને ચતુરસીમા આ મુજબ છેઃ ઉત્તરઃ પ્લોટ નં. ૩૪ ની મિલકત, દક્ષિણઃ પ્લોટ નં. ૩૩ પૈકી અન્ય મિલકત, પૂર્વઃ પ્લોટ નં. ૩૨ ની મિલકત, પક્ષિમઃ ૭-૫૦ મીટર પહોળો રોડ
2.	શ્રી કિશોરભાઈ કુઠાડા શાખા ઓફિસઃ વેરાવળ (e-UBI) (047520)	ડિમાન્ટ નોટીસ તારીખ: 22.05.2021 રૂા. 16,21,968.05 and અને વ્યાજને આધીન	રદેણાંક ઘર બિલ્કીંગ બાંધકામ જમીન પ્લોટ નં. ૩, સીટી સર્વે બ્લોક નં. ''બી'', સર્વે નં. ૬૮ પૈકી વેરવળ, જીહ્યોઃ ગીર સોમનાથમાં આવેલ મિલકત અને ચતુરસીમાઃ ઉત્તરઃ પ્લોટ નં. ૪ ની મિલકત, દક્ષિણઃ પ્લોટ નં. ૨ ની મિલકત, પૂર્વઃ બંદર રોક, પશ્ચિમઃ પ્લોટ નં. ૬ ની મિલકત
3.	શ્રી વિરેન હરેશ ગણાત્રા શાખા ઓફિસઃ વેરાવળ (e-UBI) (047520)	ડિમાન્ટ નોટીસ તારીખ: 29.05.2021 રૂા. 6,42,578.21/- and અને વ્યાજને આધીન	ઈક્વિટેબલ ગીરો મિલકત, રામ મંદિર પાસે, જમીન ક્ષેત્રફળ ૨૬૩-૮૫-૧७ સ્કે. મીટર્સ, ગામ આદ્રી ની ગામતલ, તાલુકા વેરાવળ, જીક્ષોઃ ગીરસોમનાથ, જૂનાગઢમાં આવેલ મિલકત જે શ્રી નાથુભાઈ પૂંનભાઈ રામની માલીકી અને ચતુરસીમાઃ ઉત્તરઃ અન્ય મિલકત અને રોડ, દક્ષિણઃ અન્ય મિલકત, પૂર્વઃ અન્ય મિલકત, પશ્ચિમઃ અન્ય મિલકત.
σU	,	୧ ୦୧ ୩, ୬ଥର: ପ୍ରଥର	સફી /- અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેં

पंजाब वैज्ञानल बैंक 🖳 punjab national bank

સર્કલ સસ્ત્ર ઓફિસ રાજકોટ - (૮૩૦૪૦૦), બીજો માળ, જેપી સેફાયર, રેસ કોર્સ રોઠ, રાજકોટ - ૩૬૦૦૦૧

કબજા નોટીસ (અચલિત મિલકતો માટે)

આથી, નીચે સહી કરનાર **પંજાબ નેશનલ બેંક** ના અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇડેશન એન્ડ રીકન્સ્ટ્રકશન એક ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓક સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો એક્ટ નં. ૫૪) ની ધારા ૧૩(૧૨) સાથે વંચાતા રૂલ ૩ હેઠળ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ન અંતર્ગત નીચે દર્શાવેલ <mark>તારીખે</mark> કરજદારો/જામીનદારો/ગીરોકર્તાને કિમાન્ડ નોટીસ જારી કરેલ હતી <mark>કે જેમાં નોટીસમાં જણાવેલ રકમ સંદર નોટીસ પ્રાપ્ત થ</mark>યાની તારીખર્થ ૬૦ દિવસોમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું.

કરજદારો/જામીનદારો/ગીરોકર્તા આ રકમ ચૂકવવામાં અસફળ રહેલ છે, આથી કરજદારો/જામીનદારો/ગીરોકર્તા અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે **તારી**પ **૧૨ ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ** ઉપરોક્ત નિયમોનાં અંતર્ગત નિયમ ૮ ના ધારા ૧૩(૪) ના અંતર્ગત નીચે હસ્તાક્ષર કરેલ અધિકારીએ પોતાના અધિકારથી નીચે દર્શાવેલ

મિલકતના માલિક અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી ચેતવણી આપવાની કે નીચે દર્શાવેલ મિલકતો અંગે કોઈ વ્યવહાર કરવો નહીં અને મિલકતો અંગેનો કોઈપણ વ્યવહાર **પંજાબ નેશનલ બેંકની** નીચે દર્શાવેલ બાકી રકમ અને ચડત વ્યાજ તથા ખર્ચા સાથે પૂરેપુરી રકમ ન ચૂકવાય ત્યાં સુધી બોજાને આધીન રહેશે ગીરવે રાખેલ અસ્કથામતો આપેલા સમયમાં છોડાવવા અંગે કરજદાર/જામીનદાર/ગીરોદારનું કાયદાના સેક્શન ૧૩ ના સબ-સેક્શન (૮) ની જોગવાઈ તરફ ધ્યા

અ. નં.	કરજદારો / જામીનદારો / ગીરોદારો નું નામ	ડીમાન્ડ નોટીસ તારીખ અને બાકી રકમ	અચલિત મિલકતોની વિગતો
1.	શ્રી આશિષ મધુકાન્ત વ્યાસ અને શ્રીમતી સ્વાતીબેન આશિષ વ્યાસ શાખા ઓફિસઃ જૂનાગઢ (023800)	ડિમાન્ટ નોટીસ તારીખ: 19.04.2021 રૂા. 17,89,625.43 અને વ્યાજને આધીન	રહેણાંક ઘર પ્લોટ નં. ૪ અને પ્લોટ નં. ૫ પૈકી સબ પ્લોટ નં. ૪/સી અને ૫/એ, બીનખેતી જમીન ટીંબાવાડી, રેવેન્ચુ સર્વે નં. ૧૨૬, ''સ્વસ્તિકધામ'', ટીંબાવાડી એરિયા, જૂનાગઢ. ચતુરસીમાઃ પૂર્વ: સબ પ્લોટ નં. ૪/બી ની જમીન પર બાંધકામ ઘર, પશ્ચિમઃ સબ પ્લોટ નં. ૫/બી, ૬/એ ની જમીન પર બાંધકામ ઘર, ઉત્તરઃ સર્વે નં. ૧૨૭ ની જમીન, દક્ષિણઃ ૯.૦૦ મીટર પહોળો રોડ
2.	શ્રી રૂપારેલીયા મહેશ અમૃતભાઈ શાખા ઓફિસઃ જૂનાગઢ (023800)	કિમાન્ટ નોટીસ તારીખ: 10.05.2021 રૂા. 14,33,478.34/- અને વ્યાજને આધીન	ઈક્વિટેબલ ગીરો મિલકત, દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કુલ ક્ષેત્રફળ હ૧૬- ૪૯ સ્કે. મીટર્સ, સીટી સર્વે બ્લોક નં. ૧૨, સીટી સર્વે નં. ૬ અને ૧૧, ''કોચ્કુંન પ્લાઝા'' નામે જાણીતું. રાણાવાવ ચોક પાસે, એમ જી રોડ, લોકલ સીટી જૂનાગઢ અને ચતુરસીમાં: ઉત્તરઃ કોમન પેસેજ અને દુકાન નું સાઈડ શટર, દક્ષિણ: દુકાન નં. ૩૧૫ સાથે કોમન દિવાલ, પૂર્વઃ કોમન પેસેજ, પશ્ચિમ: દુકાન નં. ૩૧૧ સાથે કોમન દિવાલ
3.	શ્રી સहાની સિંઘી રવિકુમાર ઘરમરાજ, શ્રીમતી રૂકમણીબેન ઘરમરાજ સિંઘી, શ્રીમતી સहાની સિંઘી ભાવીકાબેન રવિકુમાર, શ્રી	22.04.2021 şı. 25,76,137.74	કોમશીંચલ બિલ્કીંગ સીટી સર્વે બ્લોક નં. ૪, સીટી સર્વે નં. ૧૦૭, એમજી રોડ, તાલુકા પોલીસ સ્ટેશન પાસે, જૂનાગઢ. ચતુરસીમાઃ ઉત્તરઃ ફાજલ જમીન, દક્ષિણઃ ફાજલ જમીન, પૂર્વઃ એમ. જી. રોડ, પશ્ચિમઃ ફાજલ જમીન બસ સ્ટેશન થી નજીક

સહી/- અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક

પેઈન્ટર ઘરમરાજ બોધુમલ સંહાની

ારીખ : ૧૨/૦૮/૨૦૨૧, સ્થળઃ જન

શાખા ઓફિસઃ જૂનાગઢ

POOJAWESTERN METALIKS LIMITED Corporate Identity Number (CIN): L27320GJ2016PLC094314

Regd Office: Plot No.1, Phase II,GIDC, Dared, Jamnagar. Guiarat - 361004. India Tel No: 288-2730088, Website:www.poojametal.com,Email-poojametals@gmail.com

NOTICE OF THE 05th ANNUAL GENERAL MEETING OF THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that in view of the continuing Covid-19 pandemic and in

accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020and Circularno. 02/2021 dated January 13, 2021 in relation to "Clarification on holding of annual general meeting (AGM) throughvideo conferencing (VC) or other audio visual means (OAVM)" (hereinafte collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physica presence of Members at a common venue, the Fifth(5th) Annual General Meeting (AGM) of the Members of PoojawesternMetaliks Limitedwill be held on Tuesday, September 14 2021 at 12:00P.M. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 5th AGM. In accordance with the General Circular No. 20/2020 dated May 5, 2020 read with

General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13,2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12,2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/ P/2021/11 dated January 15, 2021 issued by the Securities ExchangeBoard of India (SEBI)the Notice of AGM along with Annual Report 2020-21 have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories Member may note that Notice and Annual Report 2020-21have been uploaded on the website of the Company at www.popiametal.com.website.of BSF Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL)i.e

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 5thAGM and Annual Report 2020-21 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

- In case shares are held in physical mode, please provide Folio No., Name o shareholder, scanned copy of the share certificate (front and back), PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to poojametals@gmail.com
 In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID
- CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested $scanned\ copy\ of\ Aadhar\ Card)\ to\ poojametals@gmail.com.$ Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.infor
- obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 5thAGM and Annual Report 2020-21and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 5thAGM. In case of any queries, shareholder may write to the Company at poojametals@gmail.com. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Wednesday, September 08, 2021 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with

Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means

The remote e-voting will commence on 9:00 A.M. on Saturday, September 11, 2021 and will end on 5:00 P.M. on Monday, September 13, 2021. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 5th AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 5thAGM may also attend the 5thAGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 5thAnnual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Wednesday, September 08, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or poojametals@gmail.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Mr. Tejus Pithadiya, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to poojametals@gmail.com or may call on +91-0288-2730088for any further

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Annual General Meeting are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM shall be counted for the $purposes\ of\ reckoning\ the\ quorum\ under\ Section\ 103\ of\ the\ Companies\ Act,\ 2013.$ For, Pooja Western Metaliks Limited

Sunil Panchmatiya
Chairman & Managing Diector Place: Jamnagar Date: August 18, 2021 DIN: 02080742